

Seat No. : _____

AK-101

August-2021

B.Com., Sem.-V

CE-301-A : Advance Accounting and Auditing (Cost and Financial Accounting)

Time : 2 Hours]

[Max. Marks : 50

- સૂચના : (1) વિભાગ-Iના બધા પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) વિભાગ-Iમાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ લખો.
(3) વિભાગ-IIનો પ્રશ્ન નં. 5 ફરજીયાત છે.

વિભાગ-I

1. એક વસ્તુ તૈયાર કરતાં પહેલા ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. ધ્રુભિલ લિ.ના ચોપડામાંથી 31-3-21 સુધીની નીચેની માહિતી મળે છે :

20

વિગત	પ્રક્રિયા-1 (₹)	પ્રક્રિયા-2 (₹)	પ્રક્રિયા-3 (₹)	તૈયાર માલ સ્ટોક (₹)
વપરાયેલ માલસામાન	20,000	30,000	10,000	–
મજૂરી	30,000	20,000	40,000	–
આખર સ્ટોક	10,000	20,000	30,000	20,000

દરેક પ્રક્રિયાની પડતરને બીજી પ્રક્રિયા ખાતે 20% નશો ફેરબદલી કિંમત પર ચઢાવીને બદલવામાં આવે છે.
ત્રીજી પ્રક્રિયાની પડતર પણ તૈયાર માલના સ્ટોક ખાતે તે જ કિંમતે લઈ જવાય છે.

દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે અંકવામાં આવે છે. તૈયાર માલનો સ્ટોક ₹ 1,80,000માં વેચવામાં આવ્યો હતો.

તૈયાર કરો : દરેક પ્રક્રિયાના ખાતાં, તૈયાર માલના સ્ટોકનું ખાતું અને ખરેખર મળેલ નશો દર્શાવતું પત્રક.

2. એક ધૂંધાડીય એકમની વિગતો નીચે મુજબ છે :

20

વર્ષ	વેચાણ (₹)	નફો (₹)
2020	2,00,000	20,000
2021	2,40,000	28,000

ઉપરની વિગતો પરથી નીચેના જવાબ ગણો :

- (1) પી.વી. ગુહોત્તર (નફો-જથ્થાનો ગુહોત્તર)
- (2) સ્થિર ખર્ચ
- (3) જ્યારે વેચાણ ₹ 1,80,000 અને ₹ 80,000 હોથ ત્યારે નફાના આંકડાઓ
- (4) ₹ 40,000નો નફો કમાવા માટે વેચાણનો આંકડો
- (5) સમતૂલ બિંદુ

3. એક કારખાનાની પ્રક્રિયા નં. 2 ની માહિતી નીચે પ્રમાણે છે :

20

વિગત	પૂર્ણતાની કક્ષા	એકમોની સંખ્યા	પડતર (₹)
શરૂઆતનો અધ્યતૈયાર માલ :			
માલસામાન	50%	600	24,600
મજૂરી	80%		
શિરોપરી ખર્ચ	80%		
પ્રક્રિયા નં. 1 માંથી ફેરબદલી	100%	7,600	2,73,600
પ્રક્રિયાનો ખર્ચ :			
માલસામાન			15,800
મજૂરી			74,800
શિરોપરી ખર્ચ			29,920
પ્રક્રિયા નં. 3 ખાતે ફેરબદલી (તૈયાર માલ)	100%	7,000	
આખરનો અધ્યતૈયાર માલ		1,200	
માલસામાન	100%		
મજૂરી	80%		
શિરોપરી ખર્ચ	80%		

તैयार કરો :

- (1) પ્રક્રિયા નં. 2 નું પ્રક્રિયા પડતર ખાતું
- (2) દિશે પદ્ધતિના આધારે પૂર્ણ એકમોનું પત્રક
- (3) પૂર્ણ એકમોના આધારે પડતરનું પત્રક
4. કંપનીઓનું સંયોજન એટલે શું ? તેના હેતુઓની ચર્ચા કરો તથા ખરીદ સ્વરૂપ અને વિલીનીકરણ સ્વરૂપના સંયોજન વચ્ચેનો તફાવત આપો.

20

વિભાગ - II

5. સાચો વિકલ્પ પસંદ કરો : (ગમે તે પાંચ)
- (1) પ્રક્રિયા પડતરમાં અસામાન્ય નુકસાનની રકમ ઉધારાય છે
- (a) નફા-નુકસાન ખાતે (b) વેપાર ખાતે
- (c) પાકા સરવૈયામાં (d) પ્રક્રિયા ખાતે
- (2) પ્રક્રિયાના હિસાબોમાં કઈ વિગત દર્શાવાતી નથી ?
- (a) દાન (b) મજૂરી
- (c) પગાર (d) માલસામાન
- (3) નીચેનામાંથી કઈ ભાબત પ્રક્રિયા પડતર સાથે સુસંગત નથી ?
- (a) સ્વયં ભાવવર્ધક (b) બાય-પ્રોડક્ટ
- (c) આંતરપ્રક્રિયા નફો (d) અસામાન્ય વધારો
- (4) પ્રક્રિયાના હિસાબોમાં પૂર્ણ એકમોની પદ્ધતિ મુજબ માલસામાનની એકમદીઠ પડતર શોધવા માટે કયું પત્રક બનાવવામાં આવે છે ?
- (a) પડતરનું પત્રક (b) પ્રક્રિયાનું ખાતું
- (c) મૂલ્યાંકન પત્રક (d) પૂર્ણ એકમોનું પત્રક

(5) ફાળો = _____

- (a) વેચાણ કિમત – ચલિત ખર્ચ (b) વેચાણ કિમત + ચલિત ખર્ચ
(c) સ્થિર ખર્ચ + ચલિત ખર્ચ (d) વેચાણ કિમત – સ્થિર ખર્ચ – ચલિત ખર્ચ

(6) ફાળો = સ્થિર ખર્ચની વસૂલાત

- (a) ખોટું (b) ખરું
(c) અધૂરું (d) કંઈ કહી ન શકાય

(7) સમતૂઠ બિંદુએ મળતો ફાળો = _____

- (a) કુલ સ્થિર ખર્ચ (b) નશે
(c) નુકસાન (d) કુલ ચલિત ખર્ચ

(8) ચોખાખી મિલકતો બાદ મૂડી અનામત ભરાબર –

- (a) ખરીદ કિમત (b) પાધડી
(c) કુલ મિલકતો (d) ત્રણ પૈકી એકેય નહીં

(9) _____ માં બંને કંપનીઓનું અસ્તિત્વ રહેતું નથી.

- (a) સંયોજન (b) સમાવેશ
(c) આંતરિક પુનઃરચના (d) બાહ્ય પુનઃરચના

(10) ચોખાખી મિલકતો \div ઈક્વિટી શેરની સંખ્યા = _____.

- (a) શેરની આંતરિક કિમત (b) શેરની બાહ્ય કિમત
(c) શેરની ઉપર કિમત (d) શેરની દાર્શનિક કિમત

Seat No. : _____

AK-101

August-2021

B.Com., Sem.-V

CE-301-A : Advance Accounting and Auditing (Cost and Financial Accounting)

Time : 2 Hours]

[Max. Marks : 50

- Instructions :**
- (1) All questions in **Section-I** carry equal marks.
 - (2) Attempt any **two** questions in **Section-I**.
 - (3) Question No. **5** in **Section-II** is **COMPULSORY**.

SECTION – I

1. One product passes through three processes before send to finished stock. The following information of Dhrumil Ltd. is available for the year ended 31st March, 2021 : **20**

Particulars	Process-1 (₹)	Process-2 (₹)	Process-3 (₹)	Finished Stock (₹)
Material consumed	20,000	30,000	10,000	—
Wages	30,000	20,000	40,000	—
C/o. Stock	10,000	20,000	30,000	20,000

The output of each process is charged to the next process at a price calculated to give a profit of 20% on the transfer price and the output of process-3 is charged to finished stock on a similar basis.

Stock in each process has been valued at prime cost. Finished stock has been sold for ₹ 1,80,000.

Prepare : Process Accounts, Finished Stock A/c and Actual Realised Profit.

2. The following is the information of a business unit :

20

Year	Sales (₹)	Profit (₹)
2020	2,00,000	20,000
2021	2,40,000	28,000

From the above mentioned information's calculate :

- (1) P/V Ratio
- (2) Fix Cost (Expenses)
- (3) Profit when Sales are ₹ 1,80,000 and ₹ 80,000
- (4) Sales to earn profit of ₹ 40,000
- (5) Break-even Point

3. The following details relate to Process No. 2 in a factory :

20

Particulars	Degree of Completion	No. of Units	Cost (₹)
Opening work in-progress :			
Material	50%		
Labour	80%		
Overhead	80%		
Transfer from Process-1	100%	7,600	2,73,600
Process Cost :			
Material			15,800
Labour			74,800
Overheads			29,920
Transfer to Process-3 (Finished)	100%	7,000	
Closing work in-progress		1,200	
Material	100%		
Labour	80%		
Overhead	80%		

Prepare :

- (1) Process cost accounts for Process No. 2.
 - (2) Statement of equivalent units (On FIFO base)
 - (3) Statement of distribution of cost on the basis of equivalent units.
4. What is amalgamation of companies ? Discuss the purposes of amalgamation and distinguish between amalgamation in nature of purchase and in nature of merger. **20**

SECTION – II

5. Choose the correct option : (any **Five**) **10**
- (1) In process cost accounts, abnormal loss is debited to
 - (a) Profit & Loss a/c
 - (b) Trading a/c
 - (c) Balance Sheet
 - (d) Process a/c
 - (2) Which item is not recorded in process accounts ?
 - (a) Donation
 - (b) Wages
 - (c) Salary
 - (d) Material
 - (3) From the following which item is not relevant to process costing ?
 - (a) Escalation
 - (b) By-product
 - (c) Inter-process profit
 - (d) Abnormal gain
 - (4) In the equivalent production of process account, which statement is to be prepared to find material cost per unit ?
 - (a) Statement of Cost
 - (b) Process Account
 - (c) Statement of Evaluation
 - (d) Statement of Equivalent Production
 - (5) Contribution = _____.
 - (a) Selling Price – Variable Cost
 - (b) Selling Price + Variable Cost
 - (c) Fixed Cost + Variable Cost
 - (d) Selling Price – Fix Cost – Variable Cost

(6) Contribution = Recovery of Fixed Costs

- (a) False
- (b) True
- (c) Incomplete
- (d) Can't Say

(7) Contribution received at Break Even Point (BEP) = _____.

- (a) Total Fixed Cost
- (b) Profit
- (c) Loss
- (d) Total Variable Cost

(8) Net Assets minus Capital Reserve is _____.

- (a) Purchase consideration
- (b) Goodwill
- (c) Total Assets
- (d) None of these

(9) Both of the old companies will not exist in _____.

- (a) Amalgamation
- (b) Absorption
- (c) Internal Reconstruction
- (d) External Reconstruction

(10) Net Assets \div No. of Equity Shares = _____.

- (a) Intrinsic value of share
 - (b) External value of share
 - (c) Yield value of share
 - (d) Face value of share
-